

WICL/SEC/2023-24

May 15, 2023

Bombay Stock Exchange Ltd. Scrip Code: 533252 Department of Listing, P. J. Towers, Dalal Street, Mumbai – 400 001. National Stock Exchange of India Ltd. Stock Symbol: WELINV, Series: EQ Exchange Plaza, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai – 400 051.

Dear Sirs/ Madam,

Subject: Newspaper Publication

In accordance with the Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached herewith a copy of the newspaper publications with respect to Audited Financial Results for the quarter and year ended March 31, 2023 published on May 12, 2023 in Financial Express (English), Kutchmitra and Kutchuday (Gujarati).

Please take the above information on record.

Thank you,

For Welspun Investments and Commercials Limited

SAND

Amol Nandedkar Company Secretary

Welspun Investments & Commercials Limited

SHREE PRECOATED STEELS LIMITED

CIN: L70109MH2007PLC174206 Regd Office: 1, Ground Floor, Citi Mall, New Link Road, Andheri (W), Mumbai - 400 053 Tel: +91-22-65526677 ∣ Website: www.spsl.com ∣ E-mail ld: spsl.investors@gmail.com

(Rs. in L							
		Standalone					
Sr. No.		Quarter ended 31-Mar-23 Audited	Quarter Ended 31-Dec-22 Unaudited	Quarter Ended 31-Mar-22 Audited	Year Ended 31-Mar-23 Audited	Year Ended 31-Mar-22 Audited	
NO.							
1	Total Income	985					
2	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional items)	(12)	(18)	(13)	(53)	(50)	
3	Net Profit/ (Loss) for the period before Tax (after Exceptional items)	(12)	(18)	(13)	(53)	(50)	
4	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional items)	(12)	(18)	(13)	(53)	(50)	
5	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(12)	(18)	(13)	(53)	(50)	
6	Equity Share Capital	414	414	414	414	414	
7	Other Equity	(0000)	0.000%	10.00	(511)	(458)	
8	Earning per Share (of Rs.10 each) (for continuing and discontinued operations)				19900	Stores	
	1) Basic	(0.29)	(0.43)	(0.31)	(1.28)	(1.21)	
	2) Diluted	(0.29)	(0.43)	(0.31)	(1.28)	(1.21)	

- related to the Company's website: www.spac.com a validate on the Company's website: www.spac.com a company are lested. as to quarter results are the balancing figures between the audited figures in late figures upto the third quarter of the respective financial pro-versancial wherever necessary.

Date: 11th May, 2023

MIHIKA INDUSTRIES LIMITED

Confirmation by the Merchant Banker

Under the paragraph 33 of the Letter of Ofter listed as "Object of the Open Ofter" an additional paragraph 3.4 shall be inserted after the 3.3.6, confirming that the parel advices taken by the regulatory adtiturbles against the target company and its promoters of disease.

3.3.6, confirming that the parel advices taken by the regulatory adtiturbles against the target company and its promoters of disease.

No Directfundirect Linkage

No Directfundirect Linkage

Under the paragraph 2.2 at the latent of Offer tisted as "Acquirer's Confirmation and Undertaking", an additional paragraph 4.3 has after the paragraph 2.2.2 attituring that the acquirer is Confirmed that there is no direct indirect privage promote public attendance on the Target Company". Intendry stancts modified for the seminance of one promote public attendance on the Target Company. Intendry stancts modified for the seminance of one promote public and the Company.

Paragraph 5.3 of the Letter of Offer under the paragraph 5 sided as "Background of the Target Company". Intendry stancts modified for the seminance of one promote public control of the Target Company of additional paragraph 4.5 and the public control of the Target Company of additional paragraph 4.5 and the paragraph 5.5 of the promote public control of the Target Company and Confirmed for the paragraph 5.5 of the late of Target Company has confirmed find any penal actions that they for regulatory additional against the Target Company controlled control of Europe 1.5 of the Target Company controlled control of Europe 1.5 of the Target Company controlled controlled and the Cause of the Cause 2.5 of the Sand Archive on material importation on the paragraph of the Target Company.

Method of Valuation of Equity Shares of the Target Company

Within Planguigh 6 of the Later of Office office as Office Pice and Financial Auragements," an additional equivalent of community of the five few has been interested only purposed in 1994. The community of the five few has been interested only purposed in 1994 the host of a The medium for our daying where so that of company, if such above an infrapose for a daying the such as commonly considered as the value of equity where of the Congrany, if such above an infrapose for the day to the such above. Each of the American Section in the Market of Market and Section in Intellectual Community in card parameters of Market and prices in Intellectual Community in card parameters of the Congrany. The Section is such as of the section in the Market and Community in Community and Communi

nfirmation on Sufficient Liquid Funds

Under paragraph 6.2 of the Letter of Offer tilled as "Financial Arrangements", an additional statement has been added to paragraph reads as, "as per the discussion with the Acquirer', we hereby confirm that the Loans and Advances shown in the Babance Sheet of as on Jan 1923, are repurpted on demand within 7 averaging days. Hence the Acquirer with a having sufficient feed infants for land in



WELSPUN GROUP WELSPUN INVESTMENTS AND COMMERCIALS LIMITED

CN - LS21000,2009P.C005195, Website : www.webpuninvestments.com Regstd, Office : Webspun City, Village Versamedi, Taluto Anjar, Dist, Klutch, Gujarat 370110 Corporate Office : Webspun House, 71h Floor, Kanala City, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai - 400013.

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER

	AND YEAR	ENDED 31 I	MARCH 202	3		(₹ in Lakhs
		Quarter Ended			Year Ended	
Sr. No.		31/03/2023	31/12/2022	31/03/2022	31/03/2023	31/03/2022
NO.		(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Audited)
1	Total Income from Operations (net)	343,38	9.00	7.93	765.42	421,51
2	Net Profit/(Loss) for the period					
l	(before Tax and Exceptional items)	334.76	-0.57	-1.20	732.00	388.27
3	Net Profit/(Loss) for the period before tax					
l	(after Exceptional items)	334,76	-0,57	-1.20	732,00	388,27
4	Net Profit/(Loss) for the period after tax					
l	(after Exceptional items)	250.55	-0.40	8.69	548.18	246.77
5	Total Comprehensive income for the period					
	[Comprising profit / (Loss) for the period (after tax)					
l	and Other Comprehensive Income (after tax)]	-3,672.88	84,35	-1,565.28	4,688.30	662.44
6	Equity share capital (Face Value ₹ 10 each)	365.45	365.45	365.45	365,45	365,45
7	Reserves (excluding Revaluation Reserves as per					
l	balance sheet of previous accounting year)	-	-	-	18,771.64	14,083.34
8	Earnings per share of ₹ 10 each					
l	(for continuing operations)					
	Basic and diluted EPS (₹)	6.86	-0.02	0.24	15,00	6.75

Place : Mumbai Date : May 10, 2023

financi<mark>alem.ep</mark> .in

- Basic and diluted EPS (**)

 0.00 | 1.4/46 | 1.4/46 | 1.4/46 |

 1) The above audited francial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 (**) The Act **) read with Rule 3 of the Companies (Indian Accounting Standards (Indian Accounting Accounting Accounting Accounting Accounting Standards (Indian Accounting Accounting Color and Indian Accounting Standards (Indian Accounting Accou

- The Company is engaged primarily in the business of investment activities and accordingly, there are no separate reportals segments apen INDA 5160-Dentaling Segments. The Company operated is nating begroup charged languaging companies and company is a Core Investment Company (CIC) which is categorised as non-deposit basing One Investment Company and no required to register with Reserve Bank of India (RBI) as per the provisions of Mater Directions. 2016. Accordingly, the Company has prepared and presented its financial results as prescribed it Schedule III Divisional (Inflo Companies Act, 2013.

 Previous period's figures have been regrouped/reclassified, wherever necessary, to correspond with those of curre-norind.
- period.
 The above is an extract of the detailed format of audited financial results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the audited financial results is available on the websites of the Stock Exchanges (www.nseindia.com, www.bseindia.com) and the Company's websites

For Welspun Investments and Commercials Limit Director DIN - 00019443

Expression of Interest (EOI)

ference to Expression of Interest (EOI) - BOM elment / EOI / 008 / 2023-24 dated 28.04.2023 p Bank's corporate website https://www.bankofmaharashtra.in. due date for bid submission is extended to 19.05.2023 @ 16:00 hd The bids will be opened online on 19.05.2023 @ 16:30 hours

The detailed corrigendum to EOI will be made available on Bank's website https://www.bankofmaharashtra.in in the 'Tenders Section' w.e.f. 11.05.2023. Bank reserves the right to cancel or reschedule the EOI process without assigning any reason.

GR Akkalkot Solapur Highway Private Limited
Registered Office: GR House, Hiran Magn, Sector 11, Udaipur, Rajasthan 313002
Email: spv@grinfra.com, Phone : +91 294-2487370 (CIN: U45201RJ2018PTC061051)

EXTRACT OF THE STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDED MARCH 31, 2023

sd/-Chief Digital Officer (CDO)

Total Income from Operations
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional

and/or Extraordinary items)

Net Profit / (Loss) for the period before tax (after Exceptions and/or Extraordinary items)

Net Profit / (Loss) for the period after tax (after Exceptional Activation (Loss) for the period after tax (after Exceptional Activation (Loss) for the period after tax (after Exceptional Activation (Loss) for the period after tax (after Exceptional Activation (Loss) for the period after tax (after Exceptional Activation (Loss) for the period after tax (after Exceptional Activation (Loss))

Net Profit (Loss) for the period after tax (after Exception and/or Extraordinary ferms)

Total Comprehensive Income for the peniod [Comprising Profit (Loss) for the peniod (after tax) and Other Comprehensive Income (after tax) and Other Comprehensive Income (after tax) and Other Comprehensive Income (after tax) and Other Reserves (excluding Revaluation Reserve)

Securities Premism Account Net Worth Account Net Worth

Net Worth

Data Graphial (Custanding Debt Coutstanding Redeemable Preference Shares)

Debt Equity Ratio

Debt Equity Ratio Earnings Per Share (of Rs. 10/- each) (* not annualised)

Basic:
 Diluted:
 Capital Redemption Reserve
 Debenture Redemption Reserve
 Debt Service Coverage Ratio
 Interest Service Coverage Ratio

Place: Gurugram Date: 11 May 2023

South Indian Bank PAT rises 23%

(₹ in lakhs except ; Quarter ended 31-Mar-23 31-Mar-22

(Audited) 2,810.98

623.73

623.73

429.85

2.34

For and on behalf of Board of Directors

For and on benaif or pour or unrecover of GR Akkalkot Solapur Highway Private Limited Varun Bhasin Director DIN: 03262761

(Audited) 2,317.43

1,274.73

1,274.73

953.91

1.66

2.48

is:

The above financial results for the year ended March 31, 2023 have been approved by the board of directors at their meeting held on May 11, 2023.

The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchange under Regulation S2 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation S2 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation S2 of Securities and Exchange levels will be uploaded on website www. grasso.com and will also be available on the Stock Exchange website www. besindia.com.

For the other line items referred in regulation S2(4) of the LODR Regulation, pertinent disclosures have been made to the SEC Limited.

KIRLOSKAR BROTHERS LIMITED

Audited Statement of Standalone and Consolidated Financial Results for the Quarter and Year ended 31 March 2023

31.03.2023 31 03 2022

1.072

795 415 1 501

159 159

Refer Note 3 Refer Note 3 Audited

577 2.073

Standalone

31,03,2023 31 03 202

25 729

1,526

12,358 11,095

Audited

22 016

1.111

810 1 039 609

A Kirloskar Group Company Registered Office : Yamuna, Survey No. 98 (3 to 7) Plot No. 3, Baner, Pune 411045

CIN: L29113PN1920PLC000670

Total income from Operation

and Extraordinary items)

3 Net Profit / (Loss) for the period
before Tax (after Exceptiona)
and Extraordinary items)

4 Net Profit / (Loss) for the period
after Tax (after Exceptional
and Extraordinary items)

5 Total Comprehensive income
for the period [Comprising
Profit / (Loss) for the period
(after tax) and Other
Comprehensive Income
(after tax)
6 Equity Share Capital

7 Reserves excluding Revaluation Reserves as per audited balance sheet of previous accounting year

accounting year
8 Earnings Per Share (Face Value of Rs. 2/- each) (from continuing operations) (not annualized)
(a) Basic
(b) Diluted

Equity Share Capital

Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and Extraordinary items)

SOUTH INDIAN BANK on Thursday reported a 22.59% increase in its March quarter net profit to ₹333.53 crore, helped by a boost from the core income. The private sector lender's net profit for the

except per share data)
Year ended on
1r-22 31-Mar-22

(Audited) 14,869.08

3,134.45

3,134.45

2,345.57

2.34

18.62 18.62

2022-23 came at ₹775.31 crore, against ₹44.82 crore in the previous year.

In the reporting quarter, its ore net interest income increased 34% to \$857 crore on the back of a 17% advances growth and a 0.17% widening in the net interest margin to 3.67%. The bank has declared

Net interest margin was 3.67% in the quarter under 5.67% in the quarter under review. Gross non-performing asset ratio fell to 5.14% as on March 31 from 5.90% a year ago. Net non-performing asset ratio fell to 1.86%, from 2.97% a year ago.

LIC MF-IDBI MF merger likely **by H1FY24**

MITHUN DASGUPTA Kolkata, May 11

LIC MUTUAL FUND expects

LIC MUTUAL FUND expects the proposed merger between it and IDBI Mutual Fund to be completed by the first half of the current fiscal.

"We are waiting for some more clarifications (regarding the proposed merger) from the regulator. Then, IDBI MF and we will have to give a one-month exit notice to the investors. We see the completion of the merger happening investors. We see the comple-tion of the merger happening may be at the end of June or July, if everything goes well. So, hopefully, by the first half of the current fiscal, it should happen," LIC MF managing director & CEO TS Ramakrish-nan told FF. nan told FE.

nan told FE.

"On a major level, we are taking care that things happen in time and customers are also benefited, as well as that we abide by all the regulations," Ramakrishnan said.

At the end of last fiscal, LIC MF's AUM stood at around ₹17,600 crore and of this, equity, including ETF equity, was close to ₹8,000 crore. UBM MF's AUM was below ₹4,000

Enriching Lives

Consolidated

31.03.2023 31.03.20

11 377 9,579

1.322 728 3.181

159

Refer Note 3 Refer Note 3

(Rupees in Million)

31.03.2023 31.03.202

1,355

965

11.615

Audited

2 511

13,881



LIC MF MD & CEC

crore at the end of FY23. With regard to the product portfolio of the merged entity, schemes that can be commonly identified would be merged. (Wherever we have gaps (in product portfolio), these will be filled with some of the products that TRINKAN these will be filled with some of the products that IDBI MF would have. Schemes that can be commonly identified will be having some schemes which we don't have; we will run those as standalone schemes," Ramakrishan informed.

For LIC Mutual Fund, the systematic investment plan's (SIP) contribution to its AUMis currently around 13%.

currently around 13%

Sundaram Home Finance Q4 net profit climbs 24%

FE BUREAU Chennai, May 11

SUNDARAM HOME FINANCE

SUNDARAM HOME FINANCE reported a 24% impin its net profit to ₹65.68 crore for the quarter ended March, compared with ₹53.05 crore in the year-ago period.
Disbursements rose 54% to ₹1,222.46 crore, compared with ₹794.08 crore. FY23, the net profit rose 29% to ₹215.81 crore, against ₹167.70 crore. Disbursements ₹167.70 crore. Disbursements ₹167.70 crore. Disbursements ₹167.70 crore. Disbursements ₹167.00 crore. Disbursements ₹167.00 crore. Disbursements €167.00 crore. Disbursem

₹215.81 crore, against \$167.70 crore. Disbursements grew 70% to ₹3,978.41 crore, compared with ₹2,336.49 crore. Assets under manage-ment stood at ₹11,005 crore, compared with ₹9,281 crore. Lakshminarayanan Duraiswamy, MD, said: "We achieved record disburse-ments of over Rs 500 crore in March. The year was also marked by our asset portfolio crossing a significant mile-stone of Rs 11,000 crore. We hired over 450 people in FY23. Overall, it has been a strong growth year for us, driven by demand in tier I and III towns in the southern market."

BOB, IDBI, SBI Capital in race to manage IREDA IPO

PRASANTA SAHU New Delhi, May 11

THREE MERCHANT BANKERS – BOB Capital, IDBI Capital and SBI Capital – are in the race to manage the initial public offering (IPC) of Indian Renewable Energy Development Agency (IREDA). Separately, Saraf and Partners, Luthra & Luthra and Crawford Bayley & Company are in the race to act as the legal adviser for the IPC.

The merchant bankers and lawfirms made their presentations to the Department of Investment and Public Asset

Investment and Public Asset Management on Wednesday. The IPO, which is expected in FY24, will likely comprise a 10% stake sale by the government and 15% fresh equity issuance by the renewable energy project financier to fund its business growth.

Listing of unlisted state-owned firms is a priority for the Centre to unlock value in these companies and also

the centre to unlock value in these companies and also improve corporate gover-nance.

- Notes:

 1 The above is an extract of the detailed format of Quarterly / Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual Financial Results and Explanatory Notes are available on the Stock Exchange websites at www.nseindia.com and ownw.bseindia.com and on the company's website at www.nseindia.com and on the company's website at www.nseindia.com and on the company's website at www.nseindia.com and on the company's website at <a href="https://www.nseindia.com and on the company sebsite at <a href="https://www.nseindia.com and sepsional in the state of the subsidiary company viz. The Kolhapur Steel Limited". This is considered as an exceptional item in the respective periods.
- 3 The figures for the quarter ended 31 March 2023 and 31 March 2022 are the balancing figures between the audited figures in respect of the full financial year and the published year to date figures upto the end of third quarter of the respective financial year, which was subjected to Limited Review.
- 4. The Board has recommended a final dividend of Bs. 4.50 per equity share (225%) subject to approval of the shareholders
- 5 The Company has received dividend from its group companies of Rs. 94.87 million during the quarter ended 31 March 2023 (PY-Rs. 68.76 million) and Rs. 112.87 million during the year ended 31 March 2023 (PY-Rs. 250.69 million)
- 6 During the quarter ended 31 December 2022, one order of the company has crossed threshold for recognition of revenue as per extant rules followed consistently, Consequently, there is a favourable impact of Rs. 313 million on profit before tax during the quarter ended 31 December 2022.
- 7 The Company's operations were partially affected by COVID during the first quarter of previous year. Consequently growth in revenue from operations in year ended 31 March 2023 is partially on account of lower base.
- 8 The Company's subsidiary The Kohapur Steel Limited' (TKSL) paid Rs. 42 million to Government of Maharashtra as per collector order dated 19 October 2022 towards change in usage of part of the land owned by it. This is considered as an exceptional item during the quarter ended 31 December 2022 and year ended 31 March 2023.

Sd/-SANJAY KIRLOSKAR CHAIRMAN AND MANAGING DIRECTOR DIN: 00007885

Tel: +91 20 6721 4444
 Email: secretarial@kbl.co.in Website: www.kirloskarpumps.com

Date : 11" May, 2023 Place : Pune



ગાંધીધામના ચેક પરત ફરવાના કેસમાં આરોપીને કેદ

ખીરીપાન કંઠ ગહીંધામ, તા. ૧૧ : અહીંના દોઢ વર્ષ અગહીંના રૂઢ. ૧.૫૦ લાખનો એક પરત થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજ કટકારવામાં આવી હતી. અહીં રહેતા નાનજ રૂપા પ્રજાપતિ પાસેશ મત્યના ત્યારા રહેતા નરેશકુમાર જીવાજ જાલિયાએ રૂ. ૧.૫૦ લાખ ઉધાર લીધેલા હતા અને જેની બેલજમાં અજારની બેંકનો દોઢ લાખનો ચેક લિયાદીને આપ્યો હતો. કરિયાદી આ ચોક વટાવવા જતાં તે વગર ચૂકવે પરત થયે હતો. તે વગર ચૂકવે

વળતર તરીકે ચૂકવી આપવા ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે કુરિયાદીના વકીલ તરીકે ધારાશાસ્ત્રી કુંદન ડી. પ્રસાદ તથા જી. વી. મનાણી હાજર રહ્યા હતા.

ગેટપાસ કોન્ટ્રાક્ટરે અદાણી પોર્ટના ૨૪ .૭૦ લાખે પચાવી પાડતાં ફરિયાદ

ભુષ્ઠ, તા. ૧૧: મુંદરામાં કરી ગેટપાસ ભનાવવાનું કામ કરાશી પાર્ટ કંપની સાથે શ. રાજ ૭૦ લાખની ઠગાઈ થયાની કરિયાદ નાંધાઈ છે. ગત વર્ષ એબ્રિલ-૨૦૨૨થી મે-૨૦૨૨ દરમ્યાન ભે માસમાં થયેલી છેતરપિંડી અંગે આજે પૂર્દરા પાંલીસ મથકે અદાભી પાર્ટના ભન્નલ મેનેજર પરેશભાઈ પીર્ટના ભન્નલ મેનેજર પરેશભાઈ કરિયાદ મુજબ ૨૦૨૦ના ભિન્નની ચક્રવાની અમય-અ-ચીમનલાલ ગોહેલે નોંધાવેલી કરિયાદ મુજબ ૨૦૨૦ના ઓગસ્ટમાં મીરા એન્ટરપાઈઝન માલિક આનંદ શભુભાઈ વ્યાસને એપી એમ સીની સિસ્ટમના યુઝર-આઈ.ડી. આપ્યા હતા. જમાંથી તેઓ ઓનલાઈન કાર્યો એન્ટ્રી માટે ગેટપાસ બનાલી કાર્યો લ્વીક્સને પોર્ટમાં પ્રવેશ આપી શર્મ

આપી શકે. આ સિસ્ટમ મુજબ ગેટપાસ બનાવવામાં આવે અને તેનું ભિલ સંભીત યુઝરને મહિનો પૂરો થયે કંપનીને આપી તેનું ચૂકવશું કંપનીમાં સાત દિવસમાં થય. ૨૦૨૦માં પીરા એન્ટસાઈઝ દ્વારા બે લાખ ડિપોઝિટ જમા કરાવી યુઝર-આઈ.ડી. એક્ટિવેટ

ભિલની ચૂકવશી સમયસર કરવામાં આવી હતી. ત્યારબાદ એપ્રિલ તથા મે-૨૦૨૨ના બે મહિનાના અદાણી કંપનીનાં બિલની રકમ રૂા. બિલની રકમ રૂા. ૨૪,૭૦,૦૧૪ ન ચૂકવી નાણાંની છેતરપિંડી કરી છે. આ બાકી ચૂકવણી અંગે ફરિયાદીએ આરોપીને

કરિયાદીએ આરોપીને અવારનવાર કોન તથા યેમેજ કરી તેમજ ફળરૂ મળીને નાશાં ચૂકવા જણાવ્યા છતાં આજદિન સુધી ચૂકવાું ન થતાં વિશ્વાસથાત તથા છત્તરપિંકીની કરિયાદ મુંદર પોલીસ મથકે નાયાઈ છે. તપાસ પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદીએ હાથ ધરી છે.

ઉમરેઠ નજીક સાત જીવને ગેરકાયદ

અમદાવાદ, તા. ૧૧ : ગીતાબેન રાંભિયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટના સહસંચાલક ચેતન્ય રાંભિયાની બાતમીના આધારે ઉમરેઠ પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ અન્ય પોલીસ સ્ટાફની મદદથી ઉમરેઠ પોલીસ સ્ટાફની મદદથી ઉમરેઠ પોલીસ

સ્ટેશન હદ વિસ્તારમાંથી બોલેરો

સ્ટશન હદ વિસ્તારમાંથ બાલત પીક્રપ ગાડી નંબર જી જૈ -૦૧-જે.ટી.-૭૦૦૯ને પકડતાં તેમાંથી પાડા-૩, પાડી એક અને ભેંસ ત્રણ મળી સાત જીવ ગેરક્ષયદેસર કતલખાને જતા હતા જેમને બચાવી અભયદાન અપાવી ગીતા સૈનિકો દ્વારા પાંજરાપોળમાં મઢી આક્રય અપાયો હતો

મૂકી આશ્રય અપાયો હતો.

Кसिख्डह 👼

अपोर्घ व्यक्ति

અઠવાડિયામાં ત્રણ દિવસ

31.3 \$ 0/-

શનિવાર પ્રતિ કો. સે.મી.

पधु भाहिती भाटे संपर्ध :

CXEC 30 35 33

કતલખાને જતા બચાવાયા



કોઠારામાં પોલીસ અધીક્ષકનો લોકદરબારઃ ગુરુવારે કોઠારા પોલીસ મથકે પોલીસ અધીક્ષક સૌરભસિંઘના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાર્યો હતો. આ વિસ્તારના કાયદો-વ્યવસ્થા તથા સારખાસિયનો અપક્ષસચાને લોકકરુંગાર યાજાયો હતા. આ વિસ્તારનો કાયદા-વ્યવસ્થા તથા ગુનાખોરી કે ગંદુપત્રિનિ એનો હોઇ પણ પ્રશ્ન હોત નિર્ભય બની જુંઆત કરવા પોલીસવડા સોરબારિય જણાવ્યું હતું. લોકો તેમનો સીધો સંપર્ધ પણ કરી શકે છે. કોઠારા પોલીસની કામગીરી પોલીસવડા અને લોકોએ બિરદાવી હતી. આ લોક્કરગારમાં પોલીસવડાની સાથે નખત્રણા વિભાગના ઉંચાનેસપી શ્રી ભગેરા તથા કોઠારા પોલીસ મશકના પીએસઆઈ વાય. પી. જોજી, કુલદીપિક્ષિક રાણા, પર્મનક્ષિક રાણા તથા પોલીસ સ્ટાક તેમજ કોઠારાના સરપંચ પ્રતિનિધિ બ્રિક્સ પરગઢ, તાલુક પોયાન પ્રમુખ મોકાજી સોઢા, ઈકબાલ મંધરા અને આજુબાજુના લોકો હાજર રહ્યા હતા. (તસવીર : મનોજ સોની)

ભુજ નગરપાલિકા જાહેર નિવિદા

ણ નગરપાલિકા માન. સાસદસભ્યશ્રીની ગ્રાન્ટ અંતગેત સાસ્કૃતિક હોલ બનાવવ ામના કોરા ટેન્ડર ફોર્મ તા. ૧૮/૦૫/૨૦૨૩ ૧૩.૦૦ કલાક સુધી મળશે. ભરેત ન્ડર ફોર્મ ટપાલ મારફતે (રજિ. એડી./સ્પીડ પોસ્ટથી) તા. ૨૨/૦૫/૨૦૨૩ સુધ ર ફોર્મ સ્થાપ મારફતે (વર્ષ: એકી.) તેમાં આપવા મારફતે (વર્ષ: એકી.) તેમાં સ્થાપ સ્થાપના પરત કરવાના રહેતો. હતર પર ફરવિયાત લખતું નામ હતે. આ અંગે અના મારિતી વર્ષા સ્થાપના સ્થાપના

ત્રિજ નગ માં. ૦૯/૦૫/૨૦૨૩ (નામાનિ-ક્ચ્છ-૧૪૪-૨૦૨૩-૨૦૨૪)

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ-નખત્રાણ વિદ્યુત પુરવઠો બંધ રહેવા અંગે

ઝાથી ઝમારા માનવંતા વીજ ગ્રાહકોને જણાવવાનું કે, ઝમારા નીચે મુજળના દ્ કે.વી. સળ સ્ટેશનોમાં અગત્યનું સમારકામ કરવાનું ઠોવાથી નીચે જણાવેલ ૧ કે.વી. ફીડમેને લીમેના સમાર દરમિયાન પાવર મળી શકશે નહીં, જેની સર્વે ઘો શાહકોએ નોંધ લેવી અને સહકાર આપવા વિનંતી.

ક્રમ	૧૧ કે.વી. ફીડરો	તારીખ, વાર	સમય
q	દૃદૃ કે.વી. મેરઉ એસ.એસ.માંથી	૧૫/૦૫/૨૦૨૩	૦૮.૦૦થી
	નીકળતા તમામ ૧૧ કે.વી. ફીકરો તથા	થી	૧૮.૦૦
	તમામ એજી ફીકરોમાં આવતા ગામકાં	૩૦/૦૫/૨૦૨૩	કલાક
	દ્દ કે.વી. બાયઠ એસ.એસ.માંથી	૧૫/૦૫/૨૦૨૩	୦८.୦୦ଥ <u>ି</u>
	નીકળતા તમામ ૧૧ કે.વી. ફીડરો તથા	થી	୧८.୦୦
	તમામ એજી ફીડરોમાં આવતા ગામડાં	૩૦/૦૫/૨૦૨૩	୫ଖା୫

કાર્ચપાલક ઈજનેર (પ્રવહન) ટ્રાન્સમિશન ડિળિ никир

ઉંંા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ 🎏

ું (ગુજરાત સરકાર સ્થાપિત ઉપક્રમ) An જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જિલ્હિંગ, પ્રથમ માળે, જી. કે. જનરલ હોસ્પિટલ સામે, ભુજ-૩૦૦ ૦૦૧. જિ. કરછ. હોલિફોન નં. ૦૨૮૩૨-૨૨૫૫૧૮

huj@gidcgujarat.org, Website: www.gidc.gujarat.gov.ir

જાહેર નિવિદા

આથી આ જહેર નિવિદા આપી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (G.I.D.C.) હારા કરજ જિલ્લામાં સ્થાપવામાં આવેલ જુવી-જુવી ઔદ્યોગિક વસાહતો જેવી કે ભુજ, ગાંધીધામ, અંજર, માધાપર, નાગોર, નાજગાયા, માંકવી, દાબ, મીકીરોહર-વ (જુપ્રકીસી), મીકીરોહર-વ (જુ.આઇ.ડી.સી.) તેમજ મુન્દ્રતાના ફાળવણીદારોનો જાય કરવાની કે GST વિભાગ હારા જાવે કરાયેલ સુધારા મુજદા - I-moice ઇશુ ચલાના હ-દિવસ ભારત આપ્લેટ કરી શકાલે નહીં, જેવી નિગમની ાઈટ www.gidc.gujarat.gov.in પર 'Quick Links' પર જ વળસાયાદ www.gioc.gujgart.govi.n પર Quick Linics પર GST Registration / Generate Property Identificatio (PIN)ના દેળ પર જાઈ પહોટ્/ગેડ વગેરેને લગતી તમામ વિના તાલાલિક દિન- ૭ (સાત)માં ભરવા વિનાંતી છે. જેથી જી.એમ.ટી કેડિટના નુક્સાન અંગેનો કોઇ પ્રમુ ઉપસ્થિત થાય નહીં સદર ભાળતને દરેક ફાળવણીદારોએ નોંધ લેવા વિનંતી.

પ્રાદેશિક મેનેજર (નામાનિ-કચ્છ-૧૪૬-૨૦૨૩-૨૦<mark>૨૪)</mark> ગુ.ઔ.વિ. નિગમ-ભુવ

ક્રાઈમ કોર્નર

વરસામેડીના વાડામાં ઊભેલી ટ્રકોમાંથી ડીઝલની તસ્કરી

વસ્ત્રીમંડીનો વાડામાં ઉાલી ટ્રેકોમાંય ડાંઝલના તસ્ત્રેય ગાંધીધામ, તા. ૧૧: અંજર તાલુકાના વસ્ત્રામંડીમાં આવેલા એક વાડામાં ઊલ્લો બે વાહનોમાંથીક, ૧૧૬ ૪ના ડીઝલની ચોરી થતાં બે રાખ્ય વિડ્ડઢ કરિયાદ નાંધાઇ હતી. વસ્ત્રામંડીમાં મનજ બન્નાજી દાકાવના એક વાડામાં જુદે- પ્રફેંડ હેમનીઓનો ટુંઠ ઉભારો હતે. વિ હોય છે. આ વાડામાં શ્રીજી ક્રિક્યોરિટીના બે ખાનગી સુરક્ષાકર્મીઓ કરજ બજાવતા હોય છે. તા. ૯-૫ અને ૧૦૦ પની ચોર્ગેક દરમ્યાન વાડામાં ઉભેલી ટુંક નખેર જી જે ૧-બી. ઝેક પ્રયુ દરમાંથી ૪૦ હિટર તથા ટુંક નખર જી જે, ૧૧ ટી.ટી. ૯૯ પત્યમાંથી ૧૦ હિટય એમ ૬૦ હિટર ડીઝલની ચોરી થઇ હતી. દરમ્યાન ફ્રિસ્ટોરિટીના જમલલિય લાખુભા જાડેજા તથા પચાવા દેવા ધેડાની પૃછાચ્છ કરાતાં તેયણો આ ખવારને અંજાન આપ્યો હોતાં, હો. ૧૬ ૧૬ ૪ના ડીઝલ ચોરીના આ ખવારને આંજા માં જણાવ્યું હતું, હો. ૧૬ ૧૬ ૪ના ડીઝલ ચોરીના આ બનાવને આંજા કે તપાસ હાથ ધરી છે.

ખારીરોહરમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર ખેલી ઝડપાયા

ગાંધીધામ, તા. ૧૧: તાલુકાના ખારીરોહરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોક્ડ રૂા. ૧૪,૮૦૦ જેન કર્યો હતા. ખારીરોહરમાં અલ્લાના પીરની દરગાહ નજીક સલીમ નૂરમામદ ભદીનાં ઘર આગળ અપુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ ભાતમીના આધારે આજે બપોરે પોલીસે કાર્યવાહી કરી હતી. આ મકાન આગળ ગંજમાના વડે પોતાનું કાવવાહા કરા હતા. આ નકાન આગળ ગજીયાના પર પતાનુ નસીબ અજમાવતા ગામના સલીમ નૂરમામદ ભદી, ગફુર નૂરમામદ ભદી, ઇશાક નૂરમામદ નિગામણા તથા રફીક નૂરમામદ ભદીને આજે બપોરે પાલીસે પકડી પાડ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. ૧૪,૮૦૦ હસ્તગત કરવામાં આવ્યા હતા.

સણવામાં ઝૂંપડું સળગાવનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

તપુંપીમાં ગૂપુંપું તપંપામી ર તેમજ પિંદુખું પીવાલ ફારવાં છે. ગાંધીધામ, તા. ૧૧: રાપર તાલુકાના સણવા ગામની સીમમાં બોરિયા વાડી વિસ્તારની એક વાડીમાં આવેલું જૂંપું સળળાવાતાં એક શપ્સ વિરૃદ્ધ પોલીસ કરિયાદ નોંધાઇ હતી. સભાવાની સીમમાં બોરિયા વાડી વિસ્તારમાં રહેના કાંગજી વસ પારકરા (કેલી)એ ખોડેકના ભરત માનસંગ પારકરા વિરૃદ્ધ પોલીસ મથકે કરિયાદ નાંધાવી હતી. ગત તા. દુ!પના કરિયાદી પોતાના પરિવાર સાથે મંદીશાંદ્યાં હતા. કરના અને સાંજ સુધી ત્યાં દોકામા હતા. દરમ્યાન, મેફબાઇ અને તેની પાની મંજુબેન પોતાના નાનાને ખળવા બોરિયા વાડી વિસારમાં ગયા હતા. અદે પતી પરત આવી. રહ્યું હતું, ત્યારે કરિયાદી નાંગજી પારકરાના ઝૂંપડાં પાસે પહોંચતાં ત્યા ભરત પારકાશ તેમાં જુંપડાને આગ લગાડી રહ્યાં હતો. જેથી દેપતીએ પડારક ડકતાં આ શપ્ય નારી ગયાં હતો. હતો. જેથી દેપતીએ પડારક ડકતાં આ શપ્ય નારી ગયાં હતો. આગના આ ત્યા ભરત પારક્શ તમના ભૂપકાન આગ લગાડા રહ્યા હતા. જથા દાતાએ અરાગર કરતાં આ શખ્ય નાસી ગયો હતો. આગના આ બનાવમાં કરિયાદીનું ઝૂંપડું, તેમાં રાખેલી ઘરવખરીની સામગ્રી, ૫૦ કિલોના ઘઉંના સાત કહ્ય, દોઢ બોરી જાર્ડ, દોઢ ભોરી રાયડો અંગરે બધું સભગી ગયું હતું જેમાં રૂદ. ૪૦,૦૦૦ની નુક્સાનીનો અંદાજ આકરામાં આવ્યો હતો. પોલીસે કરિયાદ નોંધી આગળની તપાસ હાથ ઘરી છે.

અજારના ચેક પરત થવાના કેસમાં એક વર્ષની સજા

જો (૧) વેડ પેરા પેપાંગ 30માં જે પંચાય પુરુ પેપાના મૂલ્યનો ચેક બું-કમાથી પરત કરવાના કેસમાં અંજારની અદાલત આરોપી અંજારના જયેશ જેરામભાઇ જોગીને એક વર્ષની સાદી કેદની સજ કરકાડી હતી. સાત્રમાં કેમના કરિયાદીને એકના મૂલની ટકમ ૧૦ દિવસમાં વળતર તરીકે ચૂલવા આદેશ કરાયો હતો. અંજા કહેરમાં ચંપકનારુ ખાતે હતા બહેર અલુલલાઇ ભણાસારીએ આ કેસની કરિયાદ કરી હતી. સુનાવશી દરમ્યાન બન્ને પક્ષને સાંભળી કોર્ટએ કેદ અને વળતરના આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં કરિયાદીના વકીલ તરીકે દર્શનાબાઇ એ શેઠ, ભરતભાઇ વી. શેઠ અને આનદ એસ. જોશી રહ્યા હતા.

આધોઇમાં ધોળા દિવસે મકાનનાં તાળાં તોડી ૩૮ હજારની મતાની તફડંચી

ગાંધીધામ, તા. ૧૧ : ભચાઉ તાલુકાના આધોઇ ગામમાં લગ્ન પ્રસંગે ગયેલા એક મહિલાના બંધ ઘરનું તાળું તોડી તસ્કરોએ રૂદ. 3૮,૫૦૦ની મતાની ચોરી કરી હતી. આધોઇના શ^{િદ}

તારકારમાં સુંત છે. ૧, ૧૦૦૧માં મતાની ચોરી કેટી હતી. આ પ્રામાંને માર્યા છે. છૂટક મંજુરી કરતા સામાંબેન્ ત્યાલાઈ ઢાઢી (પટેલ) નામના આદે ક મિકાલો એ ચોરીના આ બનાવ એને પોલીસ મથકે કરિયાદ નાંધાવી હતી. અહીં એકલા એતા આ મહિલાના બે દીકાર્ય મુંબઇ એક છે અને દીકારી સાસારિયે રહે છે. ગતા. તા. 23/5૧માં સાચારે ૯ વાગ્યે આ આદેક મહિલા ગામમાં લગ્ન પ્રસાને ગયા હતા. સાહ અગિયાર વાગ્યાના અરસામાં તેઓ પરત ઘરે આવતાં તેના ઘરના દરવાજાનું તાલું કરતાજાનું તાલું કરતાજાનું તાલું કરતાજાનું તાલું કરતાજાનું તાલું કરતાજાનું તાલું કરતાજાનું તાલું

તેમના ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જણાયું હતું અને દરવાજાને કડી મારેલી હતી. આ મહિલા અંદર જતાં ઘરમાં તમામ

વસ્તુઓ વેરવિખેર પડી હતી. કબાટ તપાસ કરતાં તેમાંથી રોકડ રૂા. ૧૨,૦૦૦ તથા સોનાની એક

૧૭ દિવસ પહેલાં બનેલા બનાવમાં પોલીસે કરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

વીંટી, ચાંદીની બંગડી, ચાંદીના વાટા, ચાંદાના બગાડા, ચાંદાના પગના અંગુદિયા, ચાંદીના પગના વીછિયા એમ કુલ રા. ૩૮, ૫૦૦ની મતાનો હાથ મારી તક્કરો નાસી ગયા હતા. ધોળા દિવસે અઠી કલાકના ગાળામાં બનેલા આ બનાવથી ભારે ચક્રચાર પ્રસરી હતી. ૧૭ દિવસ અગાઉ બનેલા

૧૭ દિવસ અગાઉ બનેલા ઘરફોડ ચોરીના આ બનાવ અંગે પોલીસે છેક ગઇકાલે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ટૂંકી મુદ્દતની જાહેર નિવિદા નંબર : ૦૧/૨૦૨૩-૨૪

q	ટેન્ડર ઈસ્યૂ કરવાની છેલ્લી તારીખ	94/04/23
5	ભરાચેલ ટેન્ડર રજિ. એ.ડી.થી પરત કરવાની છેલ્લી તારીખ	૨૧/૦૫/૨૩
3	ભરેલ ટેન્ડર ખોલવાની તારીખ (શક્ય હશે તો)	23/04/23
8	કેન્ડર ફી	₹1. ₹00/-

પ્રોટેન્ડર એ શક્ય હશે તો તા. ર૩/૫/૨૦૨૩ના ૧૨ કલાકે લાજર રહેલ ઇંજારદારોની રૂળગુમાં ખોલવામાં આવશે. નિવિદાની અન્ય વિગતો કચેરીમાંથી મળશે. ટેન્ડર ફોની રકમનો ડી.ડી. કાર્યપાલક ઇંજનેરશી, પંચાયત સિંચાર્ધ વિભાગ-ભુજ-ભક્કાના નામનો આપવાનો રહેશે નાચળ કાર્યપાલક ઇંજનેરની કચેરી, ભુજ જળસિંચન પેટા વિભાગ (પં.) કેમ્પ, પવન ચક્કી, ભુજ-હથ

(નામાનિ-કચ્છ-૧૪૪-૨૦૨૩-૨૦૨૪)

દાતા પરિવારના સહયોગથી કરાયેલી વ્યવસ્થાનું રવિવારે થશે લોકાર્પણ

કારાઘોઘામાં અનેરી પહેલ… ઘરવિહોણા ૨૦ કુટુંબને મળશે મકાન : મહાજન માટે વતનમાં 'નિરાંત'નું નિર્માણ

વિસામો સહ વિવિધલક્ષી હોલ'નો

૮.૩૦ વાગ્ય યાજાશ. કચ્છના ગામડાંમાં મહાજનોની વસતી વધે તથા મહાજનો મહારાજસાહેબના સાંનિધ્યમાં રહી ધર્મ ઉપાસના કરી શકે અને પોતાના વતનમાં શાંતિનું જીવન જીવી સાધના કરે તેવા આગય સાથે માતા શાતિનું જીવન જીવી સાધના કર તેવા આશય સાથે માતા પાનબાઈ ભાણજી ઘેલાભાઈ સેયા પરિવારના પુત્રો હત્સીચંદભાઈ, રમણીકભાઈ અને અમરતલાલભાઈ તથા પુત્રી જસવંતીબેન પ્રેમજ સાવલાના સોજન્યથી કારાયોધા ગામમાં જે લોકો પાસે પરનું ઘર નથી તેવા લોકોને નજીવી કિંમતે ૨૦ ઘર બનાવી આપણાં આવા છે બનાવી આપવામાં આવ્યા છે.

મોંઘવારી ધ્યાને લઇ વિધવા

બહેનોને અપાતી સહાયમાં

ભુજ, તા. ૧૧ : વિધવા બહેનોને પેન્શનમાં વધારો કરવા, નક્લી હળદર, મસાલા તેમજ શહેરમાં સફાઇ, માર્ગના

કામોની તપાસ કરવા મુખ્યમંત્રી તથા કલેકટરને રજૂઆત કરાઇ

આ અંગે ક્રિમાંશુ ગોર દ્વારા કરાયેલી રજૂઆત મુજબ હાલની મોંઘવારીને હ્યાનમાં લઇ ૧૨૫૦ રૂા. મળતી વિધવા સહાયમાં વધારો કરી આ બહેનોને ગૃહઉશોગ મળી રહે તેવી યોજના બહાર પાડવા, ભુજમાં નક્લી હળદર, મસાલાની તપાસ કરવા, આદેગમાં સકાનો આવા તથા

શહેરમાં સફાઇનો અભાવ તથા

તાજેતરમાં બનેલા ડામર અને

સીસી રોડની તપાસ કરવા માંગ

.. આ અંગે હિમાંશ ગોર દ્વારા

વધારો કરવા માંગ

સમગ્ર પ્રકલ્પને પૂર્ણ કરવામાં

વિવિધવલી હોવ'નો ઉદ્ધાટન સમારોહ મુંદરા ચીવટપૂર્વક આવાસ નિર્માણ તાલુકના કારાયોયા ગામે તા. કરાવી સપૂર્ણ સંકુલ વિકસાવ્યું છે ૧૪-૪૫ના રવિવારે સવારે અને ભરિષ્યમાં આખાય સંકુલની પડિ. ૩૦ વાગ્યે યોજાયો. કચ્છના ગામડાં માના જાળવાી પણ પાનભાઈ કચ્છના ગામડાં માના ભાજી થોલાભાઈ પરિવાર દ્વારા મહાજનો મહારાજસાહેબના તે ઉપરાંત એકાકી જીવન સાનિષ્યમાં રહી પર્ય ઉપયાસના ગુજરાત વડીલો માટે 'વડીલ કરી શકે અને પોતાના વતનમાં વંદના'ની પણ સુવિધા શાંતિનું જીવન જીવી સાધના કરે વિકસાવવામાં આવી છે, તેમને તેવા આશાય સાથે માતા ત્યાં આશ્વસ પ્યાણે તેમજ કાયમી

વિક્સાવવામાં આવી છે, તેમને ત્યાં આશ્રય અત્યાં તેમજ કપાયી ભોજના આવી છે. તે સિવાય કોઈ સાયકોને સાયકોને સ્વાતા કરવા હોય કહેવામાં આવી છે. તે સિવાય કોઈ સાયકોને સ્વાતા કરવા હોય તો શયનખંડ પણ બનાવવામાં આવા છે.
મુંજઈ જેવા મહાનગરોમાં રહેતા મહાજનો દોડાયાભવી કિંદની છે છે તે વતનમાં પાછ કરી 'નિરાંત'થી અને શાંતિથી ધર્મની જ્યાંત પ્રજાબલિત કરે, જ્યાંત પ્રજાબલિત કરે, જ્યાંત પ્રજાબલિત કરે,

જ્યોત

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ભુજોડી સ.ડી.-કચ્છ જાહેર વિજ્ઞાપ્તિ જાહેર વિજ્ઞપ્તિ

અત્રેની કહેરીમાં નીચે જણાવેલ ફીકરો જરૂરી સમારકામ માટે તા. ૧૩-૦૫-૨૦૨૩ન રોજ બંધ રહેશે. કામ પૂર્ણ થયે બીધુ સુચના વગર વીજપુરવાડો પુન: કાર્યરત થશે. ભુજોડી પે.વિ. કહેરી ફીલ્ટ સેન્ટર નં : ૦૨૮૩૨-૨૪૨૨૩૮/ દુ ૩૫૭૩૨૭૩૬૫ સેટકો જેલુવાય ૦૭.૦૦થી ૧૪.૦૦ હેગ્ગમ્મ જિલ્લા ૦૭.૦૦થી ૧૪.૦૦ લેર ગામ, શિણાય નગર, આશાપુરા તા. ૧૩.૦૫.૨૦૨૩ કંપની, સેટકો ફીકરમાં આવતા શનિવાર તમામ વિસ્તાર



ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન કિવિગ્રન ઓફિસ, ગેટકો, અંજર

વીજળી પુરવઠો બંધ રહેવા બાબતની જાહેરાત ારા માનવંતા ગ્રાહકોને જાણ કરવાની કે તા. ૧૩.૦૫.૨૦૨૩

શ**િવાર**ના રોજ અગત્થનું સમારકામ હોવાથી નીચે દર્શાવેલ ગ્રામ્ય, શહેરી **૨** ઔદ્યોગિક વિસ્તારોને નીચે જણાવેલ સમય દરમ્યાન વીજ પુરવઠો મળશે નહીં.

સબ સ્ટેશનનું નામ	તારીખ/દિવસ	સમય	૧૧ કેવી ફીકરો
દૃદ્દ કે.વી. કગારા સબ સ્ટેશન	૧૩.૦૫.૨૦૨૩ શનિવાર	સવારના ૦૮.૩૦ વાગ્યાથી ૧૫.૦૦ વાગ્યા સુધી	(૧) ૧૧ કે.વી. માધવ (AG) (૨) ૧૧ કે.વી. ગોકળ (AG)

કાર્ચપાલક ઇજનેર (પ્રવહન) ૨૨૦ કે.વી. સબ સ્ટેશન, ગેટકો, અંજાર (કર

WELSPUN GROUP WELSPUN INVESTMENTS AND COMMERCIALS LIMITED

, Vilage Versamedi, Taluka Anjar, Dist. Kutch, Gujarat 3' ırın House, 7th Floor, Kamala City, Senapati Bapat Marş ver Parel (West), Mumbai – 400013.

	AND YEAR		MARCH 202	R THE QUAK 3		(₹ in Lakhs)	
Sr.	Particulars	Quarter Ended			Year Ended		
		31/03/2023	31/12/2022	31/03/2022	31/03/2023	31/03/2022	
NO.		(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Audited)	
1	Total Income from Operations (net)	343.38	9.00	7.93	765.42	421.51	
2	Net Profit/(Loss) for the period						
	(before Tax and Exceptional items)	334.76	-0.57	-1.20	732.00	388.27	
3	Net Profit/(Loss) for the period before tax						
	(after Exceptional items)	334.76	-0.57	-1.20	732.00	388.27	
4	Net Profit/(Loss) for the period after tax			2,000			
	(after Exceptional items)	250.55	-0.40	8.69	548.18	246.77	
5	Total Comprehensive income for the period						
	[Comprising profit / (Loss) for the period (after tax)						
	and Other Comprehensive Income (after tax)]	-3,672.88	84.35	-1,565.28	4,688.30	662.44	
6	Equity share capital (Face Value ₹ 10 each)	365.45	365.45	365.45	365.45	365.45	
7	Reserves (excluding Revaluation Reserves as per		55,000,000		1.0000000000000000000000000000000000000		
	balance sheet of previous accounting year)				18,771.64	14,083.34	
8	Earnings per share of ₹ 10 each						
	(for continuing operations)						
	Basic and diluted EPS (2)	6.86	"n n2	0.24	15.00	6.75	

otes:
The above auclited financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 (the Act)* read with Ibuk 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and the Companies (Indian Accounting Standards) Rules, 2015 and the Companies (Indian Accounting Standards) Amendment Rules, 2016 and and its most offsignification of the SERI (Litting Obligations and Disciouser Requirements) Regulations, 2015, Indiading relevant circulars issued by time to time. The statification and Disciouser Requirements (Regulations, 2015, Indiading relevant circulars issued by time to time. The statification and Disciouser Requirements) Regulations, 2015, Indiading relevant circulars issued by the Results of the Company have cannot evid and out of the alternation flame circular standards.

000

000

Date: May 10, 2023

CMYK ___

CMYK —

SZEI LIEZI વેશાખ વદ - ७, તા.૧૨ મે, શુકવાર

તંત્રી સ્થાનેથી.... શું લોક્સભાની ચૂંટણી વહેલી આવશે ?



દેશમાં મિશન ૨૦૨૪ એટલે કે લોકસભાની ચૂંટલીનો માહોલ સર્જિયલો જોવાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પુનઃ સત્તા આંચકવા તો તેમની વિકાસ રકતારને રોકવાની દીશામાં વિપક્ષ પણ એજુંદ્ર થવા પામી રહ્યો હોય તેવા ઘટનાક્રમો સત્તત સામે આવવા પામી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ તથા અમિતભાઈની જોડી ચૂંટલીઓને લઈને હમેશા આઠ દસ માસ પહેલા જ આંતરીક અને ભાલ યમધમાટ શરૂ કરી દેતા હોય છે. હાલમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી અલગ અલગ રાજયોની મુલાકાત લઈ રહ્યા છે અને આ રાજયોમાં કરોડોના અધધ્ય વિકાસકામોની બેટ આપી રહ્યા છે તે પ્રથમ સંકેત જલાઈ રહ્યો છે કે, લોકસભાની ચૂંટલી કદાચ વહેલી આવી શકે છે. આવી શકે છે.

આવા શક છ. લોકસભાની ચૂંટણીને આડે આમ તો એકાદ વર્ષનો સમય બાકી છે પરંતુ લોકસભાની ચૂંટણીનો વ્યાપ જે વિસ્તાર વ્યાપાક હોય છે તેને જોતા એક વર્ષનો સમય વધુ ન કહી શકાય. હાલમાં ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આરએસએસ સહિતનાઓ સકીયતાથી વિવિધ રાજ્યોમાં પડાવ નાખી અને પાયાના સ્તરેથી જરૂરી તમામ હલચલને વેગવાન બનાવી રહ્યા છે તો બીજીતરફ વિપશી દર્શનો વધ મોદીની વિજય રકતાર પર બ્રેક મારવાન દીશામાં હરકતમાં આવી નાદાના પત્રબ રહ્તાર પર શ્રેક નારવાન દાસાના હરકતના આવા ગયેલા જોવાઈ રહ્યા છે. આ ઉપરાંત કેટલાક રાજયોની અંદર જે રીતે રાજકીય સખળડખળ પણ ઉભા થઈ રહ્યા છે તે પણ લોકસભાની ચૂંટણી સાથે જોડીને જ જોવાઈ રહ્યા છે. આજે પણ વડાપ્રધાન મિશન ગુજરાત પર આવેલા છે અને અહી તેઓએ ૪૪૦૦ કરોડથી વધુ ૨કમની ભેટ વતનને ધરી દીધી છે. આ તમામ ઘટનાક્રમોને જો લોકસભાની ચૂંટશીના વહેલા પડધમ વાગી રહ્યા હોય તેમ જોવાઈ

ચેક પરતના કેસમાં આરોપીને ૧ વર્ષની સજાનો ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

ગાંધીધામ : ચેક પરતનાં કેસમાં આરોપીને ૧-વર્ષની સજાનો ધાક બેસાડતો ચુકાદો ગાંધીધામ કોર્ટ દ્વારા આપવામાં

આવ્યો છે. કે માર્ક માર્ક અવિ એ કે આરોપી નરેશકુમાર જ્વાજી જાલીયા, રહે.પ્લાટ નં.દ૦, સપનાનગર, ગાંધીધામ વાળાએ કરીવાડી નાનજ રૂપાભાઈ પ્રજાપતિ પાસેથી હાથ છીખાં રૂા.૧,પ૦,૦૦૦/- ઉપાર લીધેલ એને પરત માંગતા તેઓએ પોતાનાં લેન્ક ભારતીય સ્ટેટ બેન્ક

નો ચેક આપેલ સદરહુ ફરીયાદી ચેક જમાં કરાવતાં તે ચેક વગર ચુકવે પરત આવેલ કેળી ફરીયાદીએ સદરહુ બાબતે કેળમાં કરાયાદાએ સદરહું બાબત કાટમા કરીયાદ કરતા ગાંધીયામનાં બીજા અધિક ચિક્ર જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબ એમ. એ.શેખ સાહેબ આરોપીને તકસીરવાન ઠેરવી ૧-વૂર્ષની સાદી કેદની સજા કેરવી ૧-વર્ષની સાદી કેદની સજા તથા ચેકની બમણી રકમ વળતર તરીકે ચુકવી આપવાનું તેવો ધાક બેસાડતો હુકમ કરવામાં આવેલ છે.આ કેસમાં ફરીયાદી તરફ વકીલશ્રી જી.વી.મનાણી અને કુન્દન ડી. પ્રસાદ હાજર રહી દલીલો કરી હતી.

માટે વેધારાની એક્સ્ટ્ર એસ. ટી. ચલાવવામાં આવી હતી તેમજ અન્ય જિલ્લાઓમાંથી કચ્છે જિલ્લામાં પરિક્ષા આપવા માટે આવેલા બેરોજગાર યુવાનોને પરિક્ષા પુરી થયા બાદ પોતાના જિલ્લામાં જવા માટે વધારાની એક્સ્ટ્ર એસ.ટી. ચલાવવામાં આવી હતી તેમજ ૮૦ જેટલી બસો ચલાવવામાં આવી હતી. ભુજ એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવેલ કામ આવેલ કામ અધ્યાન અમાં આવેલ કામ અધ્યાન અધ્ રવાપરના વોર્ડ નંબર પના રસ્તા પરનું દબાણ દૂર કરવા માંગ વ્યાપના વોર્ડ નંબર-પમાં આંગલવાડી એકની બાજુમાં જાહેર સરકારી રસ્તા ઉપર કરાયું કે તેને નાટીસ આપવાની કહેર સરકારી રસ્તા ઉપર કરવાનું કે તેને નાટીસ આપવાની પણ તજવીજ હાથ ધરી નથી પણ તજવીજ હાથ ધરી નથી પણ તજવીજ હાથ ધરી નથી તહું રજુભાતમાં જણાવાયું હતું. કરવા માટે ગ્રામ પંચાયતને અને તાલુકા પંચાયત, વોર્ડ સદસ્ય

WELSPUN GROUP WELSPUN INVESTMENTS AND COMMERCIALS LIMITED

CIN-LS21006,2208FLC055198, Website: www.webpuninvestments.com Regstd, Office: Webpun CiVillage Versamed, Tabka Anje, Disk LANK, Gujarat 370110 Corporate Office: Webpun House, Tin Floor, Kanala CiV, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai – 400013.

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER

_		Quarter Ended			Year Ended	
Sr. No.		31/03/2023	31/12/2022	31/03/2022	31/03/2023	31/03/2022
NO.		(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Audited)
1	Total Income from Operations (net)	343.38	9.00	7,93	765.42	421.51
2	Net Profit/(Loss) for the period					
	(before Tax and Exceptional items)	334.76	-0.57	-1.20	732.00	388.27
3	Net Profit/(Loss) for the period before tax					
	(after Exceptional items)	334.76	-0.57	-1.20	732.00	388.27
4	Net Profit/(Loss) for the period after tax				7 (7	
	(after Exceptional items)	250.55	-0.40	8,69	548.18	246.77
5	Total Comprehensive income for the period			/ -		
	[Comprising profit / (Loss) for the period (after tax)					
	and Other Comprehensive Income (after tax)]	-3,672.88	84.35	-1,565.28	4,688.30	662.44
6	Equity share capital (Face Value ₹ 10 each)	365.45	365.45	365.45	365.45	365.45
7	Reserves (excluding Revaluation Reserves as per		LA I			
	balance sheet of previous accounting year)				18,771.64	14,083.34
8	Earnings per share of ₹ 10 each					
	(for continuing operations)		-			
	Basic and diluted EPS (₹)	6.86	-0.02	0,24	15,00	6.75

lesses and nutties error (r) 6.00 mg - 4.00 mg

Previous persons rightles have been responsed.

The above is an extract of the detailed format of audited financial results filled with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Regulations). Pagulations, 2015. The full format of the audited financial results is available on the websites of the Stock Exchanges (www.nseinda.com, www.bseinda.com) and the Company's websites (www.welspuninvestments.com).

For Welspun Investments and Commercials Limited Auti Discourages.

પશ્ચિમ કરછ પોલીસ વડાના કોઠારા લોક દરબારમાં ભુજનાનાગિયારી ગામે ગેરકાયદેસરના ખનિજયોરી પર કડક કાર્યવાહીના નિર્દેશ



કોઠારા પોલીસ મથકના વાર્ષિક ઈન્સપેક્શન હેઠળ સૌરભ સિંઘ દ્વારા પોલીસ ખાતાને લગતા પ્રશ્નોની સુનાવણી હાથ ધરાઈ

કરવા આહવાન કરાયું હતું. ડો.સોકત સુમરાએ કોઠારા પોલીસ મથકની કામગીરીને બિરદાવી હતી.વરાડીયાના મીઠુભાઈ જેપારે પણ સ્ટાકની સક્રિયતા સાથે ત્વરીત કામગીરી સકિયતા સાથે વરીત કામગીરી યતી હોવાનું જણાવું હતું. જેકબાલભાઈ મંધરાએ જીલ્લા ક્યારે એકલાને પલીતો ત્યાં માન્ય કરી હતી. એકલાને પલીતો ચોધતા તત્ત્વો સાથે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેઓ અભારાસ હિત કચ્છમાં રાજ્યકાહી જમાનાથી ચાલી આવતી કોમી એકલા અને ભાઈચારો જભાવાઈ રહે તેવી આશા વ્યત્ત કરી હતી. અબહાસા હતા લાધ મસ્લિયમ દિતાનાલ સ્લિયમ દિતાનાલ મસ્લિયમ દિતાનાલ સ્લિયમ દિતાનાલ મસ્લિયમ દિતાનાલ સ્લિયમ દિતાનાલ મસ્લિયમ દિતાનાલ સ્લિયમ દ્વાનાલ સ્લિયમ દ્વાનાલ સ્લિયમ દ્વાનાલ સ્લિયમ દિતાનાલ સ્લિયમ દ્વાનાલ સ્લિયમ સ્ તાલુકા મુસ્લિમ હિતરક્ષક સમીતીના પ્રમુખ સાલેમામદભાઈ પડયાર દ્વારા કોઠારા પોલીસ મથકની કામગીરી બીરદાવી

યાજાયલા લાક દરભારમાં અપાયા હતો. કોઠારા પોલીસ મથકના લાર્પિક ઈન્સપેક્શન હેઠળ છેલ્લા બે દિવસથી કોઠારા સ્થાયી થયેલા પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ્ સિંઘ દ્વારા કોઠારા પોલીસ

સારભ સિંધ દ્વારા કાંઠારા પાલાસ મથક હેઠળના વિસ્તારોમાં ખનીજ એરી થતી હોવાની બાબત ધ્યાને આવી છે તે અંગે સતત નીરીક્ષણ સાથે આવી ગેરપ્રવૃત્તિ કદાપી નહીં ચલાવી લેવાય તેમ જણાવી

કોકારા પોલીસ સાથે જીલ્લા અને રાજ્ય સ્તરથી પણ કાર્યવાહીના સંકેત આપ્યા હતા. લોક દરબારની શરૂઆતમાં

કોઠારા પી.અસ.આઇ.શ્રા વાય.પી.જાડેજા દ્વારા સૌને આવકાર આપી નાગરીકો અને અગ્રણીઓને પોલીસ ખાતાને લગતી કરીયાદો કે સુચનો રજુ

डच्छ िस्साना

એસ.ટી.વિભાગની

પ્રશંસનીય કામગીરી

પ્રશંસનીચ કામગીરી ભૂજ : તાજેતરમાં બેરોજગાર ખુવાનોને તહારો મંગીની પરીશા આપવા માટે કચ્છ જિલ્લાના બેરોજગાર યુવાનોને પરિશા સેન્ટર કચ્છ જિલ્લામાં ન મળેલ હોવાયી હજારો બેરોજગાર પુવાનોને પરિશા આપવા માટે ભુજ થી મોરબી, રાજકોટ, જામનગર જિલ્લામાં તલાટી મંગીની પરીશા આપવા માટે ભુજથી રાજકોટ જામનગર જિલ્લામાં જવા માટે, ભૂજો એસ.ટી. વિભાગીય નિયામક, ભૂજથી બેરોજગાર યુવાનોને પરિશા આપવા ભુજો મોરબી, રાજકોટ જિલ્લા જવા માટે તમજ પરિશા આપવા ભુજો મોરબી, રાજકોટ જિલ્લા જવા માટે તમજ પરિશા આપવા ભુજો મોરબી, રાજકોટ જિલ્લા જવા માટે વધારાની એક્સ્ટ્રા એસ. ટી.સલાવવામાં આવી હતી તમજ અન્ય જિલ્લાઓમાંથી કચ્છ

પી.એસ.આઈ.શ્રી

કોઠારા

આજન મોબાઈલ યુગમાં ઘરના મહિલા સદસ્યોના મોબાઈલના ઉપયોગ પર વડીલો નજર રાખે તેને સમયની માંગ જણાવી હતો. તેમણે પરપ્રાંતિય ખેડુતો અને મજુરોને વાડીએ કામે રાખતી વખતે પુસ્તા કાગળાની ચકાસણી કરવા પર ભાર મુક્યો હતો. રજુઆતોનો પ્રતિસાદ આપતા શ્રી સોરભ સિથે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસ દરમ્યાન તેમણે સરહારી વિસ્તારના અનેક ગામોની જા દિવસ દરમ્યાન તમણ સરહદા વિસ્તારના અનેક ગામોની મુલાકાત લીધી હતી તે દરમ્યાન કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા તેને બિરદાવી હતી. કોઠારા વિસ્તાર વિક્સી રહ્યો છે.અહીં પવનચક્કીઓના કેબલ ચોરીની ઘટનાઓ અને બેન્ટોનાઈટ સહિતની માઈનીંગ પ્રવૃત્તિઓ થકી અમુક વિસ્તારમાં

ખનીજ ચોરી થઈ રહી છે તે અંગે જણાવ્યું હતું કે નાગરીકો પોતે કાયદો હાથમાં ન લે સ્થાનિક તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી જરૂરી માહીતી આપી હતી

મુંદરા પોર્ટના ૨૪.७० લાખ ન ચુકવી ખાનગી પેઢીની ઠગાઈ હોય છે. તા. ૯-૫ અને ૧૦-૫ની રાત્રિ દરમ્યાન વાડામાં ઊભેલી ટ્રક નંબર જી.જે. ૧૨-બી. ઝેડ-૪૫૯૧માંથી ૪૦

ભુજ : મુંદરામાં અદાશી પોર્ટ કંપની સાથે રા. ૨૪.૭૦ લાખની ઠગાઈ થયાની કરિયાદ નોંધાઈ છે. ગત વર્ષ ગેમિલ-૧૦૨૧થી મે-૨૦૨૨ દરમ્યાન બે માસમાં થયેલી છેતરપિં ડી અગે મુંદરા પોલીસ મથકે અદાશી પોર્ટના જનરલ મેનેજર પરેશભાઈ ચીમનલાલ ગોહેલે નોંધાવેલી કરિયાદ મુજબ ૨૦૨૦ના ઓપ્સ્ટમાં મીંચ એન્ટરપાઇઝના માલિક આનંદ શંભુભાઈ વ્યાસને એ પી એમ સી.ની સ્થિટસના એ. આનંદ શંભુભાઈ વ્યાસને એ.પી.એમ.સી.ની સિસ્ટમના યુઝર-આઈ.ડી. આપ્યા હતા. જમાંથી તેઓ ઓનલાઈન કાર્ગો જેમાંથી તેઓ ઓનલાઈન કાર્યો એન્ટ્રી માટે ગેટપાસ બનાવી કાર્યો લકીક્સને પોર્ટમાં પ્રવેશ આપી શકે. આ સિસ્ટમ મુજબ ગેટપાસ બનાવી એટપાસ બનાવવામાં આવે અને તેનું થુકવાયું કંપનીમાં સાત ફિન્નસમાં થાય. ૨૦૨૦માં મીટા એન્ટરમાઈઝ દ્વારા બે લાખ પિપોઝિટ જમા કરાવી યુઝરન્આઈ.ડી. એક્ટરીવેટ કરી ગેટપાએ લાખ કેટપાએ કરાવી યુઝરન્આઈ.ડી. એક્ટરીવેટ કરી ગેટપાએ અન્ટાવવાનાં ક્યા આ

આવી હતી. ત્યારબાદ એપ્રિલ તથા મે-૨૦૨૨ના બે મહિનાના અદાજ્ઞી કંપનીનાં બિલની ૨કમ્ રૂા. ૨૪,૭૦,૦૧૪ ન ચૂકવી નાણાંની છેતરપિંડી કરી છે.

વરસામેડીના વાડામાં ઊભેલી ટુકોમાંથી ડીઝલની તસ્કરી ગાંધીધામ

તાલુકાના વરસામેડીમાં આવેલા



રૂા. ૬૧૬૪ના ડીઝલની ચોરી થતાં ફરિયાદી દેવેન્ટર્જિંગ ર્થતાં ફરિયાદી દેવેન્દ્રસિંહ દતરાજસિંહ જાડેજાએ બે શખ્સ દતરાજસિંહ જાડેજાએ બે શખ્સ ત્વરુદ્ધ કરિયાદ નોંધાવી હતી. વરસામેડીમાં મનજી ધનજી દાકડાના વાડામાં જુદી-જુદી કંપનીઓની ટ્રક ઊભી રહેતા હોય છે. આ વાડામાં શ્રીજી સિકયોરિટીના બે ખાનગી સુરક્ષાકર્મીઓ ફરજ બજાવતા

ખારીરોહરમાંથી ચાર જુગારી ઝડપાયા

બી. ઝેડ-૪૫૯૧માંથી ૪૦ લિટર તથા ટ્રક નંબર જી.જે. ૧૧ ટી.ટી. ૯૯૫૯માંથી ૨૭ લિટર એમ ૬૭ લિટર ડીઝલની ચોરી થઇ હતી. સિકયોરિટીના

ગાંધીધામ : તાલુકાના ખારીરોહરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. ખારીરોહરમાં અલ્લાના પીરની દરગાહ નજીક અલ્લાના પીરની દરગાદ નજીક સલીમ નૃરમામ ભકીનાં ઘર આગળ અમુક શખ્યો જુગાર રમતા હોવાની ભાતમીના આધારે નસીબ અજમાવતા ગામના સલીમ નૃરમામદ ભકી, ગૃહુર નૃરમામદ ભકી, ઇશાક નૃરમામદ નિગામજ્ઞા તથા રક્કી નૃરમામદ નહીંને પોલીસે પ કડી રોકડ રૂા. ૧૪,૮૦૦ કબજે કર્યા હતા.

નખત્રાણામાં વીજ કરંટ

લાગતા યુવકનું મોત

નખત્રાલા : અહા જૂનાવાસમાં રહેતા ૨૮ વર્ષિય પાર્થ ગૌતમભાઈ પટેલને વીજ

કરંટ લાગ્યો હતો. હતભાગી

રુરટ લાગ્યા હતા. હતભાગા ગુરૂવારે બપોરે પાશીની મોટર ચાલુ કરવા ગયો ત્યારે સ્વીચ ચાલુ કરતી વખતે ઘટના બની હતી. જેથી તેને સારવાર માટે

નખત્રાણા

આડેસર ચેક્પોસ્ટ પાસે બે ટ્રેઈલર અથડાતા ચાલક-ખલાસીના મોત

ગાંધીધામ : રાપર તાલુકાના આડેસર નજીક ચેકપોસ્ટ પાસે આગળ જતા ટ્રેઈલરમાં પાછળથી પુરપાટ આવતું ટ્રેઈલર અથડાતા ટ્રેઈલ્વરની કેબીનમાં દબાઈ જવાના કારણે ચાલક અને ખલાસીના મોત કારણ ચાલક અને ખલાસીના માત થયા હતા. રાજસ્થાનના રાજગઢમાં રહેતા ટ્રેઈલર ચાલક શુભકરણ હતુમાનસિંઘ જાટે જણાવ્યું કે, તેઓ ટ્રેઈલરમાં ગવારનો પાવડર લોડ કરી મુંદરા પોર્ટ જવા નિકળ્યા

આઇ.ડા. અક્ટલપ્ટ કરા ગેટપાસ બનાવવાનું કામ ચાલુ કરાયું હતું. માર્ચ-૨૦૨૨ સુધી મીરા એન્ટરપ્રાઈઝ દ્વારા બિલની.

ચુકવણી સમયસર કરવામાં

હતા, ત્યારે ચેકપોસ્ટ પર ધીમેથી વાહન હંકારતા હતા તે દરમ્યાન પાછળથી પુરપાટ આવેલા ટ્રેઈલરના ચાલકે વાહનમાં ટ્રેઈલરના ચાલક અને ક્લીનર કેબીનમાં દબાઈ ગયા હતા. જેમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ચાલક ઈલીયાસખાન સુકેદાખાન અને ક્લીનર નીર્ટ્સની ગીરીરાજ્સૈની હરસોરાના મોત

હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જયાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કમાગુનામાં નદીમાંથી રેતી લઈ જવાની ના કહેતા ગળું દબાવાયું

ભુજ : તા રેતીચોરી

તાલુકાના કમાગુના કમાગુનાના બસ સ્ટેશન પર બનાવ ગામે દેતીઓરી બાબતે યુવાનનું બન્યો હતો. ઈજા પામનાર ગામનો ગળું છતાવવામાં આવતા સારવાર ઈજાહીમ ઈમલા ત્રાયા બસ સ્ટેશન માટે હોસ્પિટલમાં ખહોડાયો હતો. પાસે હતો ત્યારે ઈજાહીમ કારમ જાજાવા મળતી વિગતો મુજબ સમાને નદીમાંથી દેતી લઈ જવાની

મેડિક્લેઈમની ખોટી રીતે કપાત રકમ વ્યાજ સહિત ચૂકવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો હુકમ

કું, લિ. પાસેથી વસુલ મેળવવા તમણે ભુજના જીકીતા પારાશાસી શંકરભાઈ સચઠ, ઉમિશ સચદે તથા હિરેન સચદે મારકતે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કોરમ, ભુજ સમક્ષ કરિયાદ અરજી દાખલ કરી હતી. આ ફરિયાદ અરજી માં કોરમે ફરિયાદી તરફથી રજુ થયેલા પરાવા તથા વિઆવાર દલીલોને કોરમે કરિયાદી તરકથી રજુ થયેલા પુરાવા તથા ઉભાવાદ દક્ષીલોને વહેલાં રાખી, ધી ઓરિએન્ટલ ઇન્બ્યોન્સ ક્રેલાં, લે એ કરિયાદીને સુકલેલ સારવારની રકમ ખોટી રીત કપત કરેલ હોવાનું હતાવી રૂ. ૪,૮૬,૦૮૫ અરજીની તારીખ ૧૦-૯-૨૦થી ૯% વ્યાજ સાથે ચુકલી આપવા હુકમ કરેલાં છે. તથા વિશેષમાં કરિયાદ ખર્ચના કરા. ૩ હજર તેમજ માનલીક આસના રૂ.૫ હજર ચુકલે આપવા માટે હકમ કરેલ છે. આ કેસમાં પટે હકમ કરેલ છે. આ કેસમાં માટે હુકમ કરેલ છે. ર ફરિયાદીવતી હિરેન દલીલો કરી હતી.

ના પાડતા ઉશ્કેરાઈને તેણે ગળું દબાવવાનું પ્રયત્ન કરતા સારવાર માટે જી.કે.માં લવાયો હોવાનું હોસ્પિટલ ચોકીની એમએલસીમાં જણાવાયં છે.

ભુજ તાલુકાના હરિપર નજ઼ક આવેલા બટ પર ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે

ભુજ : તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૪ (52 Med Regt) 75 (I) Inf Bde ઉપર તા.૧૩/૫ સુધી ૫૯ Bn BSFના તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાનારી છે. જેથી આ ફાયરિંગ યાજાનારા છે. જેથા આ કાયારળ દેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશલું નહીં અથવા ઢોરોને પ્રવેશલા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયુરિંગ્ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેવું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા

કોમર્શિયલ દબાણ દૂર કરાયા



ભુજ : તાલુકાના નાગીયારી ગામે નખત્રાણ *ત્યા^{રડ}* ગામે નેખત્રાણા હાઈવે પર મોકાની જગ્યા પર કુલ જ દિમાં લાર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી આશરે પપરપ યો. જમીન પર વાત્રિજયક દભાલ કરાના અવેલ હતું, જે જમીનની આશરે બજાર કિંમત રા. ર૭, ૫૦,૦૦ દજ્ટલી થાય છે. આ દભાલ દુર કરવા ભુજ શ્રામ્ય મામલતદાર વી.એચ. બારહ્ટ લાર દભાલદારને ધોરકાસને નોટીશ આપવામાં આવેલ હતી તેમ છતાં આ દભાલો દુર ન થતાં કહેકટરના સુચનાથી નાયબ કહેકટરના સુચનાથી નાયબ કહેકટરના સુચનાથી નાયબ કલેકટરના માર્ગદર્શન તળે ધોરણસર દબાણ

દુર કરવામાં આવ્યા હતા. આ વેળાએ માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો વ્યવસ્થા જળવવામાં આવ્યો હતો. આ કામગીરી મામલતદાર ભુજ ગ્રામ્ય તથા તેમના સ્ટાફ, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય, પોલીસ ખાતુ, પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી હતી. સ્થાનિકે કોઈ અનિચ્છનીય બનાવ સ્થાાનક કાંઇ આને સ્કુગાય બનાય બન્યો ન હતો. આ પ્રકારની દબાશ હટાવવાની કાર્યવાહી તંત્ર દ્વારા નિયત સમયાંતરે ચાલુ રાખવામાં આવશે તથા જે ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાશ કરવામાં આવે છે. તેઓને કબ્જો છોડી દેવા તાકીદ કરવામાં આવી છે

ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે સમર કેમ્પ યોજાશે

ભુજ : કચ્છ જિલ્લાના ભુજ : કચ્છ (જલ્લાના પાટનગર ભુજમાં આવેલ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના માર્ગદર્શન હેઠળ્ રેસીડેન્શિયલ સમર કેમ્પ્નું અગે જેન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ અને ગમ્મત સાથે વિજ્ઞાન, ગણિત અને ટેક્નોલોજી વિશેના જ્ઞાનમાં અને ટેક્નોલોજી વિશેના જ્ઞાનમાં વખારો કરી શકશે. ઉનાળુ વૈકેશન દરામિયાન સમયનો સદુપયોગ થાય અને બાળશે મોબાઈવ, કોમ્પ્યુટર, વિશેઓ ગેમથી દૂર રહે તેમજ વિજ્ઞાન ગણિત જેવા વિશ્વોમાં પ્રેક્ટિકલ જ્ઞાન મળે, વિવિધ મોડેલ્સ અને પ્રયોગો દ્વારા વિશાન વિપયને જાણવા – સમજવા મળે તે હેતુથી આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપારોક્ત આયોજનમાં પ્રથમ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપારોક્ત આયોજનમાં પ્રથમ સમર કેમ્પ તા રહે મો છી ૧૯ અ શ્રી છી ૧૯ અ છે થી ૭૦ સમર કેમ્પ તા રહે મો છી ૧૯ અ શ્રી છી ૧૯ અ છે થી ૭૦ સ્થાર્ચ કેમ્પના રહેમાં તા રહે મો છી ૧૯ અ શ્રી ૭૦ સ્થાર્ચ કેમ્પના ૧૯ ઓ થી ૭૦ સ્થાર્ચ ૭૦ સ્થાર્ય ૭૦ સ્થાર્ચ ૭૦ સ્થાર્ચ ૭૦ સ્થાર્ચ ૭૦ સ્થાર્ચ ૭૦ સ્થાર્ચ ૭૦ સ્થાર્ય ૭૦ સ્થાર્ય ૭૦ સ્થાર્ચ ૭૦ સ્થાર્ચ ૭૦ સ્થાર્ચ ૭૦ સ્થાર્ચ ૭૦ સ્થ છે. ઉપરોક્ત આયોજનમાં પ્રથમ સમર કેમ્પ તા. ૧૭ મે થી ૧૯ મે દરિયાના, બીજો કેમ્પ રુપ થી ૧૯ મે અને ત્રીજો કેમ્પ ૩૧ મે થી ૧૬ મે અને ત્રીજો કેમ્પ ૩૧ મે થી ૧૬ જુન, ૨૦૨૩ દરિયાના યોજવામાં આવશે. દરેક સમર કેમ્પ ૩ દિવસનો રહેશે. આ કેમ્પ માં ભાગ લે નાત વિદ્યાર્થિઓએ ૩ દિવસ અને ૨ સત્રિ રોકાલ કરવાનું રહેશે. તેમને રહેવાની

તથા જમવાની વ્યવસ્થા રિજનલ સાયન્સ સેન્ટર - ભુજ દ્વારા કરવામાં આવશે. સમર કેમ્પ માં અલગ અલગ વિષયના તજજ્ઞો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરા વામાં મન્યું મુશ્કાર કરાવવામાં આવશે. આ 3 દિવસ દરમિયાન રિજનલ સાયન્સ તેન્ટર – ભૂજ દ્વારા વિવધ પ્રવૃતિઓ કરવવામાં આવશે. જેમાં વૈજ્ઞાનિક મોડેલનું નિદર્શન, સ્કાય ગેડ્રીગ, વૈજ્ઞાનિક પ્રયોગો, ઇન્ડસ્ટ્રી વિઝીટ, ઓરીગામી, ત્યેર વોક, યોગ, ચેસ કોમ્પીટીશન, આઉટડોર્સ ગેમ્સ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે આ 1મ, આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને અનોખો આનંદ માણી શકશે. દરેક સમર કેમ્પમાં ચેરજ ૮ અને ૮ ના વિદ્યાર્થીઓ 30 જેટલી પ્રયાધીદતા સુંખ્યામાં અગાઉના કરાવવામાં આવશે. આ ૩ દિવસ દરક સમર કમ્પના પારતા ૮ જન્મ ૮ ના વિશાર્થીઓ 30 જેલ માર્યાદિત સંખ્યામાં અગાઉના ઘોરણના માર્કસના આધારે મેરિટ મુજબ લેવામાં આવશે. તેમ રિજનલ સાયન્સ સેન્ટર - ભુજના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સાહેબ દ્વારા જુશાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. નં. 93.23 ૧ ૪૪૦૨૦ -૯૯૭૮૪ ૩૬૦૩૦ પર સંપર્ક કરવા જુશાવાયું છે.





THE KERALA STORY:- 11.00AM, 01.30PM, 03.00PM, 04.15PM, 05.30PM, 08.00PM, 10.00PM, 10.30PM YUG PURUSH SADGURU SAI TEOONRAM (SINDHI) :

BUSHIRT-TSHIRT (GUJARATI) :- 03.15PM IB71 (HINDI) :- 10:15AM, 12.30PM, 05.45PM, 10.40PM FARHANA (HINDI) :- 10:00AM

CHATRAPATHI (HINDI): 12.45PM, 08.15PM
PROGRAMMING & PRICING ARE SURJECT TO CHANGE WITHOUT PRIOR NOTICE



માંડવી ન.પા. વિસ્તારમાં ૧૪મું નાણાપંચ પરકોર્મન્સ ગ્રાન્ટ વર્ષ ૨૦૧૭-૧૮ હેઠળ જોગી સ્મશાન અને ગોસ્વામી અખાડાની કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી (છકો પ્રયત્ન)

8895EG

... .. અત્રેની કચેરીના આંધકામ વિભાગથી કોરા ટેન્ડર જાહેરાત પ્રસિદ્ધ થયાન અત્રના કરવાના ભપકામ પાલભાગથાં કરા ટન્ટર જાહરાત પ્રાસ્ત થયાના દિલ્ન-૭ (રુપતા દિલ્લો સિવાપ) સુધી (ભાગા પ્રીપોટીટ-૫૦૦૦૦૦ ટેન્ટર કી-૯૦૦.૦૦) ટેન્ટર દીઠ સાંજે ૦૨:૦૦ કલાક સુપીમાં મેળવી લેવાના રહેશે.
 ... કોડવુમેન્ટ સમમીશન કન આર.પી. એન્નિટમીડ પોસ્ટમી ચીક ઓફિસ્સ, મોઠવી નગરપાલિકા, મોહની-કચ્છ, ૩૦૦૪૯માં જહોત પ્રતિક્રયાના દિલ્નના દિલસો સિવાય) સુપીમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. ઉ. ટેન્ડર સ્વીકાર/અસ્વીકાર કરવાની આખરી સત્તા નગરપાલિકા ચીક ઓફિસરર્ન

તંત્રી, મુદ્રક, પ્રકાશક અને માલીક ગંગારામ એલ. ભાનુશાલીએ કચ્છ ઉદય, પ્લોટ નં.પપ, વોર્ડ નં.પબી (છુઆઈડીસી), ૩৬૦૨૦૫ આઈપુર ખાતેથી છપાવી, પ્લોટ નં.૨૮৬, સેક્ટર-૧એ, ગાયત્રી મંદીરની બાજુમાં, ગાંધીધામ (કચ્છ)થી પ્રસિદ્ધ કર્યું. ભુજ ઓફીસ : ૧૦ -આનંદ ચેમ્બાર્સ, બીજા માળે, હોટલ પ્રિન્સની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, ફોન : ૨૨૪૧૯૬, ૨૪૨૯૬, ૨૫૧૦૯૬ અંજાર બ્યુરો : નગરપાલિકા કોમ્પલેસ, મામલતદાર કચેરીની સામે, ફોન : ૨૪૦૬૪૪, રાપર બ્યુરો : અંબાવી કોમ્પલેસ, પાટીદાર વાડીની સામે, ફોન : ૨૬૩૧૮૫.